



જાહેર સુચના

જી.એમ.ડી.સી. ના અગાઉથી નોંધાયેલા તેમજ નવા ઉત્પાદક યુનીટ ધારકોને વર્ષ ૨૦૨૧-૨૨ની સિઝન દરમિયાન લિઝાઇટ મેળવવા બાબત

જી.એમ.ડી.સી.માં અગાઉ નોંધાયેલા તેમજ માત્ર ઓક્ટોબર-૨૦૨૦ થી જુન-૨૦૨૧ દરમિયાન લિઝાઇટનું લિફ્ટિંગ કરેલ હોય તેવા બ્રિક્સ યુનીટ ધારકોએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે લિઝાઇટ ક્વોટા માટેની ફાળવણી શરૂ કરાવવા માટે નીચે મુજબની સુચનઓ અનુસાર ડોક્યુમેન્ટ જમા કરાવવા:

- ૧) માત્ર અગાઉથી નોંધાયેલા તેમજ ઓક્ટોબર-૨૦૨૦ થી જુન-૨૦૨૧ દરમિયાન લિઝાઇટનું લિફ્ટિંગ કરેલ હોય તેવા બ્રિક્સ યુનીટ ધારકોએ માટે તેમનું હાલનું Valid GPCB CCA અથવા ૦૧ વર્ષના ગાળામાં ઇશ્યુ થયેલ GPCB NOC/CTEની સ્વયંપ્રમાણિત નકલ જમા કરાવવી.
- ૨) ઇંટભટ્ટો / યુનીટ ચાલુ હોય તે જગ્યાનું બિનખેતી કરાવેલ હુકમની સ્વયં પ્રમાણિત નકલો, તેમજ સંલગ્ન ૭/૧૨ની લેટેસ્ટ સ્વયં પ્રમાણિત નકલ, તેમજ જો જમીન ભાડેથી લીધેલ હોય તો ભાડાકરારની સ્વયં પ્રમાણિત નકલ
- ૩) વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ ની રોયલ્ટી ભર્યાની પહોંચની સ્વયં પ્રમાણિત નકલ
- ૪) ઉપરાંત જો કોઈ અન્ય વિગતમાં ફેરફાર થયેલ હોય તો તેનો લેટરપેડ પર સ્પષ્ટ ઉલ્લેખ કરી જરૂરી કાગળો અને પુરાવાઓ સહિત મોકલવું ઇ.ત. GPS, GST, PAN, UAN, FL, DIC, ROC, Bank Account, email ID, Mobile Number etc.
- ૫) જો કોઈ યુનિટમાં કોઈપણ કારણથી નામફેર થયો હોય, સ્થળ બદલાયું હોય, માલિકીહક બદલાયો હોય તો નવા રજીશ્ટ્રેશનને લાગુ પડતી સુચનઓ મુજબ નવા ફોર્મ સાથે અરજી કરવી.
- ૬) પ્રોસેસિંગ ફી રૂ.૧૧૮૦/- સાથે ઉપરમુજબના ડોક્યુમેન્ટ આ સાથેના ગુજરાતી વિગતપત્રક ફોર્મેટમાં વિગતો ભરી જમા કરાવવા. અગાઉથી નોંધાયેલ અને ઓક્ટોબર-૨૦૨૦ થી જુન-૨૦૨૧ દરમિયાન લિઝાઇટનું લિફ્ટિંગ કરેલ હોય તેવા બ્રિક્સ યુનીટ ધારકોએ ફરીથી રજીશ્ટ્રેશન ફી આપવાની રહેશે નહીં.



નવા ગ્રાહકોએ રજીસ્ટ્રેશન ફોર્મમાં જણાવ્યા પ્રમાણેની સુચનાઓ મુજબ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે તેમજ ગુજરાતી વિગતપત્રક ફોર્મેટમાં વિગતો ભરી જમા કરાવવાની રહેશે.

1. માંગેલ દસ્તાવેજ ચેકલિસ્ટમાં ટિકમાર્ક કરવા તેમજ ચેકલિસ્ટ પ્રમાણેના ક્રમમાં જ જમા કરાવવા.
2. માત્ર જે તે ગ્રાહકના નામના જ email ID અને Mobile No. ફરજિયાતપણે જણાવવા.
3. રજીસ્ટ્રેશન ફોર્મમાં માગ્યા મુજબના GPS Coordinates લેવા Android મોબાઇલ ફોનમાં Google Maps એપ્લિકેશનનો ઉપયોગ કરી સાઇટ લોકેશન લેવું.
4. અગાઉ નોંધાયેલા કસ્ટમર આઇડીનો રજીસ્ટ્રેશન ફોર્મમાં ઉલ્લેખ કરવલ.(જો હોય તો)

ઉપરમુજબના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ થોડાક દિવસો ચકાસણી માટે થાય છે અને ત્યારબાદ મંજૂર થયેલ ગ્રાહકોને તે પછીના પખવાડીયામાં ક્વોટા ફાળવણી કરવામાં આવે છે. જે અંગેની માહિતી ગ્રાહકના નોંધાયેલ email ID અને Mobile No. પર આપવાવામાં આવશે, તેમજ વેબસાઇટ પર પણ ક્વોટા ફાળવણીમાં જોઇ શકાશે.

અધુરી માહિતી ભરેલ ફોર્મ, અપુરતા અથવા સહી-સિક્કા વગરના દસ્તાવેજ, તેમજ ચેકલિસ્ટ પ્રમાણે ક્રમવાર દસ્તાવેજ નહીં ગોઠવેલ ફાઇલોનો સીધેસીધો અસ્વીકાર કરવામાં આવશે, જેની નોંધ લેવી.

વધુ માહિતી કે માર્ગદર્શન માટે:

Sales Customer Care No: 63599 47641

GMDC Land Line: 079 2791 3200 Extn. No.: 1706

E-Mail: sales@gmdcltd.com

Website: www.gmdcltd.com

સરનામું:

**SALES & MARKETING DEPARTMENT, 3rd Floor, GMDC LTD. 'Khanij Bhavan',
132' Ft Ring Road, University Ground, Vastrapur, AHMEDABAD - 380 052**